

ત્વરિત જાહેરાત માટે

## સિટી ઓફ બ્રેમ્પટન સામાજિક સુરક્ષા અને ગુનાખોરી નિવારણ માટે પ્રોવિન્શ્યલ નીધિયનને આવકારે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (24 જાન્યુઆરી 2020) – આજે સિટી ઓફ બ્રેમ્પટનને ઓન્ટારિયો સરકાર દ્વારા સામાજિક સુરક્ષા પહેલોને મજબૂત કરવા સંસાધનો વધારવા માટે જાહેર કરાયેલ પીલ રીજનલ પોલીસ માટેના \$20.5 મિલિનના નીધિયનને આવકાર્યું હતું.

જાહેરાત દરમિયાન પીલ પોલીસ સર્વિસિસ બોર્ડના પદાધિકારી એવા મેયર પેટ્રિક બ્રાઉને (Mayor Patrick Brown) આ રોકાણની અગત્યતા વિશે વાત કરી, જે પીલ રિજનલ પોલીસના કમ્યુનિટી મોબિલાઈઝેશન પ્રોગ્રામ અને ઓન્ટારિયોના ગન્સ, ગેંગ્સ એન્ડ વાયોલન્સ રિડક્શન સ્ટ્રેટેજીને સમર્થન આપે છે.

સિટી ઓફ બ્રેમ્પટન નિરંતરપણે વધુ મજબૂત અને વધુ સુરક્ષિત સમુદાયો બનાવવામાં વધુ સહયોગના હિમાયતી રહ્યા છે. 2019 એસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીઝ ઓફ ઓન્ટારિઓ (AMO) વાર્ષિક કોન્ફરન્સમાં મેયરશ્રીની આગેવાની હેઠળના શહેર ડેવિલોપમેન્ટ દ્વારા સહયોગની વધુ જરૂરિયાત વિશે, તેમજ સરકારના તમામ સ્તરે પ્રવૃત્તતા અને નીધિયન માટે સમર્થન મેળવવા સોલિસિટર જનરલ સાથે સીધી વાત થઈ જેથી સિટી ઓફ બ્રેમ્પટન અને સમગ્ર રિજન ઓફ પીલમાં સામાજિક સુરક્ષા અને સુખાકારી માટે એક વ્યાપક અભિગમ અપનાવી શકાય.

આજની નીધિયન જાહેરાત ચાલી રહેલ સંખ્યાબંધ ભાગીદારીઓ માટે પણ પૂરક છે જે બ્રેમ્પટનના સામાજિક સુરક્ષાના પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે જેમાં નીચેની બાબતો સામેલ છે:

- ડાઉનટાઉન બ્રેમ્પટન સબસ્ટેશન શરૂ કરવાની પીલ રિજનલ પોલીસની તાજેતરમાં કરાયેલ જાહેરાત જેથી જે ત વિસ્તારના લોકો માટે તેઓની હાજરી અને કાળજીમાં વધારો થઈ શકે.
- સિટી ઓફ બ્રેમ્પટન લાઈટહાઉસ પ્રોગ્રામ જેનાથી આખો સમુદાય અસરગ્રસ્ત થયો હોય એવી કટોકટીઓ દરમિયાન, સહભાગી થયેલ ધાર્મિક સંગઠનોની મિલકતોમાં સમાજ આશ્રય મળવી શકે.
- દેખરેખ કરવાની ક્ષમતાઓને સુધારવા માટે 410 અને 403 હાઈવે પર CCTV કેમેરા ઈન્સ્ટોલ કરવાની સિટીની હિમાયત.

### અવતરણો

"ગુના આચરતી ગેંગ માટે વિસ્તારની મર્યાદા હોતી નથી. તે આખા GTAની સમસ્યા બની રહે છે. આપણે ક્યારેય ગુનાહિત સંગઠનોની કુતર્ક ક્ષમતાઓનું અધોમૂલ્યન કરવું જોઈએ નહીં જેઓને બરાબર જાણ હોય છે કે કયા વિસ્તારોમાં પ્રતિભાવ આપવાની ક્ષમતા ઓછી છે. હું પ્રિમિયર

ફોર્ડ અને જનરલ જોન્સનો આભારી છું કે તેઓએ ગન્સ એન્ડ ગેંગ્સ ફ્રિંગ માટેની આપણી પોકાર સાંભળી. આ આપણી પોલીસ માટે મહત્વપૂર્ણ ઓળખ છે જેથી બ્રમ્પટન અને પીલ પ્રાંત સુરક્ષિત રહી શકે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન અને સદસ્ય, પીલ પોલીસ સર્વિસિસ બોર્ડ

"સુરક્ષિત માર્ગો વિના તમે ક્યારેય એક મહાન શહેર ઊભું કરી જ ન શકો. તાજેતરમાં જ શરૂ થયેલ ગન્સ એન્ડ ગેંગના સળવળાટને તે શરૂ થાય ત્યાર પહેલા જ ડામી દેવો પડશે. અને તે ત્યારે જ થઈ શકે જ્યારે સરકારી તંત્રના દરેક સ્તર સાગમટે કાર્યરત થાય. આ નીધિયનની જાહેરાત પીલ રિજનલ પોલીસને જરૂર છે એવા સંસાધનો પૂરા પાડવામાં લાંબી મજલ કાપશે જેથી તેઓ બ્રમ્પટનને વધુ સુરક્ષિત બનાવી શકે.

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams), સિટી કાઉન્સિલર અને પ્રમુખ, કમ્યુનિટી સેફ્ટી એડવાયઝરી કમિટી

"આ મહત્વપૂર્ણ ટર્મ ઓફ કાઉન્સિલની અગ્રિમતાને આગળ ધપાવવા માટે આપણે જે કંઈ કરશું તેનું હાઈ તે છે કે નિરોગી અને સુરક્ષિત શહેર બનાવવા માટે યોગ્ય વાતાવરણનું સર્જન કરવામાં આવે. યોગ્ય દિશામાં ઉપાડેલ દરેક પગલું સમાજને સુરક્ષિત બનાવશે અને નિવાસીઓ, હિસ્સેદારો અને રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારશે અને આપણા શહેરની લાંબા ગાળાની સફળતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલ્લો કરશે.

- ડેવિડ બેરિક, મુખ્ય વહીવટકર્તા (David Barrick, Chief Administrative Officer)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાઈ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ટુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)